



# THE NAVNIRMAN CO-OPERATIVE BANK LTD.

"NAVNIRMAN BANK BHAVAN"

OPP. SHRIMALI SOCIETY, RASALA MARG, NAVRANGPURA, AHMEDABAD-380 009

PHONE : 26568256, 26568257, 26568258. FAX:(079) 26568257

No.NNCB / ૨૦૨૫-૨૬ / ૨૧૦

તા. ૧૨/૦૮/૨૦૨૫

પ્રતિ,  
શાખા મેનેજરશ્રીઓ,  
ધી નવનિર્માણ કો-ઓપ. બેંક લી.,  
તમામ શાખા, અમદાવાદ.

## વિષય : ધિરાણના વ્યાજ દરોમાં ફેરફાર કરવા બાબત.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સની તા.૩૦/૦૮/૨૦૨૫ ની મીટીંગમાં ધિરાણના વ્યાજ દરોની ચર્ચા વિચારણા કરી ધિરાણ વ્યાજના દરોમાં તા.૦૧/૦૮/૨૦૨૫ ના રોજથી અમલમાં આવે તે રીતે અનુ.નં.(૫), (૧૨) અને (૧૬) તથા અગત્યની સુચનામાં નીચે મુજબ ફેરફાર કરવામાં આવેલ છે.

| અ.નં. | ધિરાણની વિગત                                                                                                                                                                                                    | તા. ૧/૮/૨૪ ના દર               | તા. ૦૧/૦૮/૨૦૨૫ ના રોજથી અમલમાં આવતા નવા વ્યાજ દર                                                                 | ક્રેડિટ સ્કેર તથા                | સીઝુરીટી લેવલ (રીવાઈઝેબલ લેવલ)                                                                                                                                               | તા. ૧/૮/૨૦૨૫ ના નવા વ્યાજ દર   |
|-------|-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|--------------------------------|------------------------------------------------------------------------------------------------------------------|----------------------------------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|--------------------------------|
| ૧     | ૨                                                                                                                                                                                                               | ૩                              | ૪                                                                                                                | ૫                                | ૬                                                                                                                                                                            | ૭                              |
| ૧     | હાઈપોથીકેશન / બીડીસીસી, GL Code-3500<br>હાઈપોથીકેશન+બીડીસીસી, GL Code-3502<br>(સ્ટોક+બુક ડેબ્ટ સામે) GL Code-3503<br>ફક્ત ચાલુ ધિરાણ માટે<br>રીન્યુઅલ સમયે આપાત્રી બેંક સિવાયના સેવિંગ્સ ખાતાના પાંચ ટકા લેવાં. | ૧૧.૫૦<br>૧૧.૫૦                 | (૧) રૂ. ૫ લાખ સુધી- મોર્ગેજ વગર<br>(૨) રૂ. ૫ લાખથી ઉપર<br>રૂ. ૧૦ લાખ સુધી<br>મોર્ગેજ વગર ચાલુ ધિરાણ વાળા માટે જ. | ૬૦૦ +<br>૬૦૦ +                   | —<br>—                                                                                                                                                                       | ૧૧.૫૦<br>૧૧.૫૦                 |
| ૨     | હાઈપોથીકેશન / બીડીસીસી, GL Code-3500<br>હાઈપોથીકેશન+બીડીસીસી, GL Code-3502<br>(સ્ટોક+બુક ડેબ્ટ સામે) GL Code-3503<br>નવું ધિરાણ તથા ચાલુ ધિરાણો<br>રીન્યુઅલ સમયે વ્યાજનો દર                                     | ૮.૫૦<br>૮.૨૫<br>૮.૦૦<br>૮.૭૫   | રૂ. ૨૫ લાખ સુધી<br>રૂ. ૨૫ લાખથી ઉપર                                                                              | ૬૦૦ +<br>૬૦૦ +<br>૬૫૧ +<br>૭૦૦ + | લઘુત્તમ ૧૦૦% સીઝુરીટી<br>૧૦૦% થી ૧૨૫% સીઝુરીટી<br>૧૨૬% થી ૧૫૦% સીઝુરીટી<br>૧૨૬% કે તેથી વધુ સીઝુરીટી                                                                         | ૮.૫૦<br>૮.૨૫<br>૮.૦૦<br>૮.૭૫   |
| ૩     | સ્થાવર મિલકત મોર્ગેજ - એસઆડીપી<br>GL Code-3506<br>વર્કીંગ કેપીટલ - સીફ્ટવોર્ડ કેસ ક્રેડિટ<br>GL Code-3504<br>સીફ્ટવોર્ડ કેસ ક્રેડિટ<br>GL Code-3507                                                             | ૮.૫૦<br>૧૦.૦૦                  | રૂ. ૨૫ લાખ સુધી<br>રૂ. ૨૫ લાખથી ઉપર                                                                              | ૬૦૦ +<br>૬૦૦ +                   | સીફ્ટવોર્ડની રીલા. વેલ્યુના ૬૦% તથા વર્ષમાં ૧ વખત સ્ટોક પત્રક અને ઉધરાણી લેવા પાત્ર.<br>સીફ્ટવોર્ડની રીલા. વેલ્યુના ૬૦% તથા વર્ષમાં ૧ વખત સ્ટોક પત્રક અને ઉધરાણી લેવા પાત્ર. | ૮.૫૦<br>૧૦.૦૦                  |
| ૪     | ટર્મ લોન-મશીનરી લોન (૩૬ થી ૮૪ હપ્તા સુધી)<br>GL Code-3640                                                                                                                                                       | ૮.૫૦<br>૮.૦૦                   | રૂ. ૨૫ લાખ સુધી<br>રૂ. ૨૫ લાખથી ઉપર                                                                              | ૬૦૦ +<br>૬૦૦ +                   | લઘુત્તમ ૧૦૦% સીઝુરીટી<br>લઘુત્તમ ૧૦૦% સીઝુરીટી                                                                                                                               | ૮.૫૦<br>૮.૦૦                   |
| ૫     | ફાઉન્ડેશન ટર્મ લોન ૧૮૦ હપ્તા સુધી<br>GL Code-3901 ના બદલે હવે પછી<br>GL Code-3601 માં જ ખાતા ખોલવાં.<br>નવા મકાનની ખરીદી માટે<br>મહત્તમ ધિરાણ રૂ. ૧૪૦ લાખ સુધી                                                  | ૮.૫૦<br>ફીક્સ<br>૮.૦૦<br>ફીક્સ | ★ (૧) રૂ. ૫૦ લાખ સુધી<br>રહેણાંકની કિંમત રૂ. ૬૩ લાખ સુધી<br>(૨) રૂ. ૫૦ લાખથી ઉપર<br>રૂ. ૧૪૦ લાખ સુધી             | ૬૦૦ +<br>૬૦૦ +                   | દસ્તાવેજના ૮૦% સુધી<br>દસ્તાવેજના ૮૦% સુધી                                                                                                                                   | ૮.૫૦<br>ફીક્સ<br>૮.૦૦<br>ફીક્સ |

★નોંધ : રૂ. ૫૦ લાખ સુધીના ધિરાણમાં રહેણાંકની કિંમત રૂ. ૬૩ લાખથી વધારે હોય તો વ્યાજનો દર ૮.૦૦% ફીક્સ લાગુ થશે.



|    |                                                                                                                                                                                                                                                                                                       |       |                             |       |                             |       |
|----|-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|-------|-----------------------------|-------|-----------------------------|-------|
| ૬  | બિલ્ડીંગ લોન - કોમર્શીયલ ૧૨૦ હપ્તા.<br>GL Code-3602<br>(મકાન/ઑફીસ/દુકાન/શેડ/ગોડાઉન) નું<br>વેલ્યુએશન કરી રીલાઈએબલ સિફ્ટરીટી આધારીત વ્યાજ દર.<br>નવી મિલ્કત ખરીદી માટે દસ્તાવેજના ૯૦% સુધી.                                                                                                            | ૮.૫૦  | રૂ.૨૫ લાખ સુધી              | ૬૦૦ + | લઘુત્તમ ૧૦૦% સીફ્ટરીટી      | ૮.૫૦  |
|    |                                                                                                                                                                                                                                                                                                       | ૧૦.૦૦ | રૂ.૨૫ લાખથી ઉપર             | ૬૦૦ + | લઘુત્તમ ૧૨૫% સીફ્ટરીટી      | ૧૦.૦૦ |
| ૭  | બિઝનેસ ફોર ટર્મ લોન ૧૨૦ હપ્તા.<br>GL Code-3615<br>(મકાન/ઑફીસ/દુકાન/શેડ/ગોડાઉન) નું<br>વેલ્યુએશન કરી રીલાઈએબલ સિફ્ટરીટી આધારીત વ્યાજ દર.<br>નવી મિલ્કત ખરીદી માટે દસ્તાવેજના ૯૦% સુધી.<br>ઉદ્યમ આધાર રજીસ્ટ્રેશન ફરજીયાત.                                                                              | ૮.૪૦  | રૂ.૨૫ લાખ સુધી              | ૬૦૦ + | લઘુત્તમ ૧૦૦% સીફ્ટરીટી      | ૮.૪૦  |
|    |                                                                                                                                                                                                                                                                                                       | ૮.૮૦  | રૂ.૨૫ લાખથી ઉપર             | ૬૦૦ + | લઘુત્તમ ૧૨૫% સીફ્ટરીટી      | ૮.૮૦  |
| ૮  | સ્પેસીફાઈડ ગવર્નમેન્ટ સીફ્ટરીટીઝ સામે.<br>GL Code-3650 NSC/KVP/LIC etc.<br>મુખ્ય કિંમતના ૭૫% સુધી.<br>(મૂકવા તારીખથી ૨ વર્ષ પછી ૯૦ ટકા લોન)                                                                                                                                                           | ૮.૫૦  | ---                         | ---   | ---                         | ૮.૫૦  |
| ૯  | એજ્યુકેશન લોન - (૮૪ માસિક હપ્તા)<br>Domestic GL Code-3620<br>Foreign GL Code-3621<br>પ્રથમ ૨૪ મહીના વ્યાજ ત્યારબાદ<br>૬૦ મહીના હપ્તો+વ્યાજ કુલ ૮૪ હપ્તા.                                                                                                                                              | ૮.૦૦  | ઐશ્વર્યિક પ્રવેશના ૭૫% સુધી | ૬૦૦ + | લઘુત્તમ ૧૦૦% સીફ્ટરીટી      | ૮.૦૦  |
| ૧૦ | પર્સનલ લોન GL Code-3600<br>રૂ.૧ લાખ સુધી જ, માસિક ૩૬ માસનાં હપ્તાથી,<br>એડવાન્સ ચેકો લઈને જ.                                                                                                                                                                                                          | ૧૨.૦૦ | ---                         | ૬૦૦ + | ---                         | ૧૨.૦૦ |
| ૧૧ | ટર્મ લોન કોમર્શીયલ વ્હીકલ<br>વધુમાં વધુ ૬૦ હપ્તા GL Code-3611<br>થી વ્હીલર લોડીંગ ટેમ્પો/ઑટોરીક્ષા/ટેક્સી<br>વધુમાં વધુ ૩૬ હપ્તા GL Code-3611                                                                                                                                                         | ૧૦.૦૦ | બેઝીક કિંમત ના ૭૦%          | ૭૦૦ + | મોર્ગેજ વગર                 | ૧૦.૦૦ |
|    |                                                                                                                                                                                                                                                                                                       | ૮.૫૦  | બેઝીક કિંમત ના ૮૦%          | ૬૦૦ + | પ્રોપર્ટી મોર્ગેજ           | ૮.૫૦  |
| ૧૨ | વ્હીકલ લોન પર્સનલ<br>નવુ વધુમાં વધુ ૬૦ હપ્તા<br>GL Code-3610                                                                                                                                                                                                                                          | ૮.૨૫  | રૂ.૫૦ લાખથી સુધી            | ૬૦૦ + | બેઝીક કિંમતના ૯૦% સુધી      | ૮.૨૫  |
|    |                                                                                                                                                                                                                                                                                                       | ૮.૫૦  | રૂ.૫૦ લાખથી ઉપર             | ૬૦૦ + | બેઝીક કિંમતના ૯૦% સુધી      | ૮.૫૦  |
|    | (૧) ટુ વ્હીલર<br>વધુમાં વધુમાં વધુ ૩૬ હપ્તા.<br>GL Code-3610                                                                                                                                                                                                                                          | ૮.૫૦  |                             | ૬૦૦ + | બેઝીક કિંમતના<br>૭૫% થી ૯૦% | ૮.૫૦  |
|    | (૨) ૩ વર્ષ સુધીની જુની ફોર વ્હીલર<br>સામે વધુમાં વધુ ૩૬ હપ્તા.<br>GL Code-3610                                                                                                                                                                                                                        | ૧૦.૦૦ |                             | ૬૦૦ + | વેલ્યુએશન ના ૭૦%            | ૧૦.૦૦ |
| ૧૩ | પ્રોફેશનલ ટર્મ લોન<br>(સેલ્ફ એમ્પ્લોયડને વ્યવસાય માટે)<br>GL Code-3618<br>ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જીનિયર્સ તથા વકીલ, આર્કીટેક<br>સેમજ અન્ય<br>ફર્નિચર અને ફીક્સર્સ માટે ૩૬ હપ્તા<br>ઘંઘો કરવા માટેની ટર્મ લોન વધુમાં વધુ ૧૨૦ હપ્તા<br>વ્યવસાયિક સાધનો ખરીદવા માટે (મશીનરી) લોન<br>વધુમાં વધુ ૬૦ હપ્તા | ૮.૫૦  | રૂ.૨૫ લાખથી સુધી            | ૬૦૦ + | લઘુત્તમ ૧૦૦% સીફ્ટરીટી      | ૮.૫૦  |
|    |                                                                                                                                                                                                                                                                                                       | ૮.૦૦  | રૂ.૨૫ લાખથી ઉપર             | ૬૦૦ + | લઘુત્તમ ૧૦૦% સીફ્ટરીટી      | ૮.૦૦  |



|    |                                                                                                                                                                                           |       |     |       |                          |       |
|----|-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|-------|-----|-------|--------------------------|-------|
| ૧૪ | કોમર્શીયલ રીયલ એસ્ટેટ -<br>RH મહત્તમ ૪૮ માસ સુધી.<br>GL Code-3704 (ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોન)<br><br>કોમર્શીયલ રીયલ એસ્ટેટ -<br>CRH મહત્તમ ૪૮ માસ સુધી.<br>GL Code-3705 (ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોન) | ૧૪.૦૦ | --- | ૬૦૦ + | લઘુત્તમ ૧૨.૫% સીઝ્યુરીટી | ૧૪.૦૦ |
| ૧૫ | Women Power GL Code-3902<br>મહિલા સ્વાવલંબન યોજના<br>રૂ. ૧ લાખ સુધી જ, માસિક ૩૬ માસના હપ્તાથી,<br>એડવાન્સ ચેકો લઈને જ.                                                                    | ૮.૦૦  | --- | ---   | ---                      | ૮.૦૦  |
| ૧૬ | મહિલા સ્વાવલંબન ટર્મ લોન<br>GL Code-3904<br>રૂ. ૫.૦૦ લાખ સુધી જ, માસિક ૬૦ માસના હપ્તાથી,<br>એડવાન્સ ચેકો અને યોગ્ય જામીન લઈને જ.                                                          | ---   | --- | ૬૦૦+  | ---                      | ૮.૨૫  |

## અગત્યની સુચનાઓ :-

| (૧)   | વ્યાજ દર વખતે વખત બેંકનું બોર્ડ ઓફ ડીરેક્ટર્સ ઠરાવે તે પ્રમાણે વધ-ઘટ થવા પાત્ર રહેશે.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                    |                        |                                   |                        |   |                                   |                       |   |                                                        |                 |   |                                                         |                   |   |                                                          |                   |   |                                                           |                   |   |                                           |                    |
|-------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|------------------------|-----------------------------------|------------------------|---|-----------------------------------|-----------------------|---|--------------------------------------------------------|-----------------|---|---------------------------------------------------------|-------------------|---|----------------------------------------------------------|-------------------|---|-----------------------------------------------------------|-------------------|---|-------------------------------------------|--------------------|
| (૨)   | રૂ. ૫ લાખથી રૂ. ૧૦ લાખ સુધી માં મોર્ગેજ વગરના કાલના ચાલુ હાઈપો / બીડીસીસી / હાઈપો + બીડીસીસી માં વ્યાજ દર ૧૧% અમલમાં રહેશે. તેમનો વ્યાજ દર રીન્યુઅલ વખતે ૧૧.૫૦% થશે. જે ખાતેદારે વ્યાજ દરમાં ઘટાડો ઈચ્છતા હોય તેમને રૂ. ૫ લાખ સુધી / રૂ. ૧૦ લાખ સુધીના ધિરાણો માં કોલેટરલ સિઝ્યુરીટી બેંકને મોર્ગેજમાં આપી વ્યાજ દરમાં ઘટાડાનો લાભ લઈ શકશે.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              |                        |                                   |                        |   |                                   |                       |   |                                                        |                 |   |                                                         |                   |   |                                                          |                   |   |                                                           |                   |   |                                           |                    |
| (૩)   | ઉપરોક્ત વ્યાજ દર તા. ૧૮/૦૫/૨૦૨૩ થી મંજૂર થયેલ ધિરાણ અરજીઓ તથા હાઈપો / બીડીસીસી / હાઈપો + બીડીસીસી ના ચાલુ ધિરાણોમાં રીન્યુઅલ સમયે ક્રેડિટ સ્કોર તથા સીઝ્યુરીટી લેવલ (રીલાઈઝેબલ વેલ્યુ) ને ધ્યાને લઈ લાગુ થવાપાત્ર રહેશે.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 |                        |                                   |                        |   |                                   |                       |   |                                                        |                 |   |                                                         |                   |   |                                                          |                   |   |                                                           |                   |   |                                           |                    |
| (૪)   | ઉપર કોલમ ૭ માં દર્શાવેલ વ્યાજના દર કોલમ નં. ૫ ક્રેડિટ સ્કોર તથા કોલમ નં. ૬ સીઝ્યુરીટી લેવલ (રીલાઈઝેબલ વેલ્યુ) બંનેની પુર્તતા થતી હોય તેને જ લાગુ પડશે. (નવા તમામ પ્રકારના લોન ધિરાણ ખાતાઓ તથા ઓવર ડ્રાફ્ટ ખાતાઓ) જો પુર્તતા ન થતી હોય તો કોલમ નં. ૭ માં દર્શાવેલ વ્યાજ દર ઉપરાંત ૦.૨૫% વધારે વ્યાજ લાગુ પડશે.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            |                        |                                   |                        |   |                                   |                       |   |                                                        |                 |   |                                                         |                   |   |                                                          |                   |   |                                                           |                   |   |                                           |                    |
| (૫)   | કાલનાં અમલી ક્લોટીંગ વ્યાજ દરવાળું નવું ધિરાણ તા. ૧૬/૧૦/૨૦૨૩ થી બંધ કરવાનું ઠરાવેલ છે અત્યાર સુધી ધિરાણ અરજીઓ જે ક્લોટીંગ વ્યાજ દરમાં મંજૂર થયેલ છે તે GL Code-3901 જ ખાતા ખોલવાં.<br>તા. ૧૬/૧૦/૨૦૨૩ થી નવું ક્લોટીંગ ધિરાણ ફીક્સ વ્યાજ દરથી જ કરવાનું ઠરાવેલ હોઈ ફીક્સ વ્યાજ દર વાળા ખાતાઓ GL Code-3601 માં જ ખોલવાના રહેશે.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            |                        |                                   |                        |   |                                   |                       |   |                                                        |                 |   |                                                         |                   |   |                                                          |                   |   |                                                           |                   |   |                                           |                    |
| (૬)   | તા. ૦૧/૦૭/૨૦૨૨ થી અમલમાં આવેલ પ્રોસેસીંગ ચાર્જ નવા મંજૂર થતા તમામ પ્રકારના ધિરાણોમાં (ફીક્સ ડીપોઝીટ સામે લોન તથા ઓવર ડ્રાફ્ટ સિવાય) લેવાનું ચાલુ રહેશે.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  |                        |                                   |                        |   |                                   |                       |   |                                                        |                 |   |                                                         |                   |   |                                                          |                   |   |                                                           |                   |   |                                           |                    |
|       | <table border="1"> <tr> <th>અ.નં.</th><th>પ્રોસેસીંગ ચાર્જ લેવાની લોનની રકમ</th><th>પ્રોસેસીંગ ચાર્જની રકમ</th></tr> <tr> <td>૧</td><td>રૂ. ૧ લાખ સુધીની વાહન લોન માટે જ.</td><td>કોઈ ચાર્જ લેવાનો નથી.</td></tr> <tr> <td>૨</td><td>રૂ. ૧ લાખથી ઉપર રૂ. ૫ લાખ સુધીના તમામ પ્રકારના ધિરાણો.</td><td>રૂ. ૫૦૦/- + GST</td></tr> <tr> <td>૩</td><td>રૂ. ૫ લાખથી ઉપર રૂ. ૨૦ લાખ સુધીના તમામ પ્રકારના ધિરાણો.</td><td>રૂ. ૧,૦૦૦/- + GST</td></tr> <tr> <td>૪</td><td>રૂ. ૨૦ લાખથી ઉપર રૂ. ૫૦ લાખ સુધીના તમામ પ્રકારના ધિરાણો.</td><td>રૂ. ૨,૦૦૦/- + GST</td></tr> <tr> <td>૫</td><td>રૂ. ૫૦ લાખથી ઉપર રૂ. ૨૦૦ લાખ સુધીના તમામ પ્રકારના ધિરાણો.</td><td>રૂ. ૫,૦૦૦/- + GST</td></tr> <tr> <td>૬</td><td>રૂ. ૨૦૦ લાખથી ઉપરના તમામ પ્રકારના ધિરાણો.</td><td>રૂ. ૧૦,૦૦૦/- + GST</td></tr> </table> | અ.નં.                  | પ્રોસેસીંગ ચાર્જ લેવાની લોનની રકમ | પ્રોસેસીંગ ચાર્જની રકમ | ૧ | રૂ. ૧ લાખ સુધીની વાહન લોન માટે જ. | કોઈ ચાર્જ લેવાનો નથી. | ૨ | રૂ. ૧ લાખથી ઉપર રૂ. ૫ લાખ સુધીના તમામ પ્રકારના ધિરાણો. | રૂ. ૫૦૦/- + GST | ૩ | રૂ. ૫ લાખથી ઉપર રૂ. ૨૦ લાખ સુધીના તમામ પ્રકારના ધિરાણો. | રૂ. ૧,૦૦૦/- + GST | ૪ | રૂ. ૨૦ લાખથી ઉપર રૂ. ૫૦ લાખ સુધીના તમામ પ્રકારના ધિરાણો. | રૂ. ૨,૦૦૦/- + GST | ૫ | રૂ. ૫૦ લાખથી ઉપર રૂ. ૨૦૦ લાખ સુધીના તમામ પ્રકારના ધિરાણો. | રૂ. ૫,૦૦૦/- + GST | ૬ | રૂ. ૨૦૦ લાખથી ઉપરના તમામ પ્રકારના ધિરાણો. | રૂ. ૧૦,૦૦૦/- + GST |
| અ.નં. | પ્રોસેસીંગ ચાર્જ લેવાની લોનની રકમ                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        | પ્રોસેસીંગ ચાર્જની રકમ |                                   |                        |   |                                   |                       |   |                                                        |                 |   |                                                         |                   |   |                                                          |                   |   |                                                           |                   |   |                                           |                    |
| ૧     | રૂ. ૧ લાખ સુધીની વાહન લોન માટે જ.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        | કોઈ ચાર્જ લેવાનો નથી.  |                                   |                        |   |                                   |                       |   |                                                        |                 |   |                                                         |                   |   |                                                          |                   |   |                                                           |                   |   |                                           |                    |
| ૨     | રૂ. ૧ લાખથી ઉપર રૂ. ૫ લાખ સુધીના તમામ પ્રકારના ધિરાણો.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   | રૂ. ૫૦૦/- + GST        |                                   |                        |   |                                   |                       |   |                                                        |                 |   |                                                         |                   |   |                                                          |                   |   |                                                           |                   |   |                                           |                    |
| ૩     | રૂ. ૫ લાખથી ઉપર રૂ. ૨૦ લાખ સુધીના તમામ પ્રકારના ધિરાણો.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  | રૂ. ૧,૦૦૦/- + GST      |                                   |                        |   |                                   |                       |   |                                                        |                 |   |                                                         |                   |   |                                                          |                   |   |                                                           |                   |   |                                           |                    |
| ૪     | રૂ. ૨૦ લાખથી ઉપર રૂ. ૫૦ લાખ સુધીના તમામ પ્રકારના ધિરાણો.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 | રૂ. ૨,૦૦૦/- + GST      |                                   |                        |   |                                   |                       |   |                                                        |                 |   |                                                         |                   |   |                                                          |                   |   |                                                           |                   |   |                                           |                    |
| ૫     | રૂ. ૫૦ લાખથી ઉપર રૂ. ૨૦૦ લાખ સુધીના તમામ પ્રકારના ધિરાણો.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                | રૂ. ૫,૦૦૦/- + GST      |                                   |                        |   |                                   |                       |   |                                                        |                 |   |                                                         |                   |   |                                                          |                   |   |                                                           |                   |   |                                           |                    |
| ૬     | રૂ. ૨૦૦ લાખથી ઉપરના તમામ પ્રકારના ધિરાણો.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                | રૂ. ૧૦,૦૦૦/- + GST     |                                   |                        |   |                                   |                       |   |                                                        |                 |   |                                                         |                   |   |                                                          |                   |   |                                                           |                   |   |                                           |                    |
| (૭)   | તમામ પ્રકારના ધિરાણોમાં - ધિરાણો ચાલુ હોય તે દરમિયાન જામીન ફેરફાર, મિલ્કત છુટી કરવા કે મિલ્કત ફેરફાર કરવાના કિસ્સામાં અરજદાર પાસેથી રૂ. ૧૦૦૦/- + GST સર્વિસ ચાર્જ જે તે ધિરાણના પ્રોકીટ એન્ડ લોસના ફેડમાં લેવાના રહેશે.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  |                        |                                   |                        |   |                                   |                       |   |                                                        |                 |   |                                                         |                   |   |                                                          |                   |   |                                                           |                   |   |                                           |                    |



|      |                                                                                                                                                                                                                                                                                    |
|------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| (૮)  | Women Power – GL Code-3902 મહિલા સ્વાવલંબન યોજનામાં રૂ. ૧,૦૦,૦૦૦/- સુધીના ધિરાણ પ્રાપ્તિની તથા વિકર સેક્ટરમાં Yes કરવા.                                                                                                                                                            |
| (૯)  | ક્લીન કેશ ક્રેડિટ પ્રોડક્ટ GL Code - 8208 બંધ કરવામાં આવે છે. ક્વે પછી નવું ક્લીન કેશ ક્રેડિટ આપી શકાશે નહીં.                                                                                                                                                                      |
| (૧૦) | રૂ. ૧૦૦.૦૦ લાખ સુધીના તમામ ધિરાણ માટે મોર્ગેજ થવાની / કરેલ મિલ્કતની રીલાઈઝેબલ વેલ્યુ ધિરાણની રકમના ૧૫૦.૦૦% કે તેથી વધારે હોય અને આવક ધરાવતા હોય તો એક જમીન અન્યથા બે કે તેથી વધારે જમીનો લેવાના રહેશે.                                                                             |
| (૧૧) | <b>MSME</b> ધરાવતા માહિતી મહિલાઓને રૂ. ૫.૦૦ લાખ સુધીની મહિલા સ્વાવલંબન ટર્મ લોન મહિલાઓને વ્યવસાય, ગૃહઉદ્યોગ, વેપાર-ધંધો કરવાના હેતુ માટે યોગ્ય સ્વીકાર્ય જમીન લઈ નિયમાનુસાર ૮.૨૫% ના વ્યાજે મહત્તમ ૬૦ માસ સુધી મેનેજમેન્ટ કમિટી, ધિરાણ કમિટી કે બોર્ડ ની મંજૂરીથી ધિરાણ કરી શકાશે. |
| (૧૨) | મોર્ગેજ વગરના એટલે કે અનસિક્રાઈડ કાઈપલ ધિરાણમાં આપણી બેંક સિવાયના સેવિંગ્સ ખાતાના એડવાન્સ પાંચ ચેકો લેવાં.                                                                                                                                                                         |

સકારની અપેક્ષા સહ.....



ધી નવનિર્માણ કો-ઓપ. બેન્ક લી.,

(ચંદ્રકાન્ત બી. જાજલ)

જનરલ મેનેજર અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફીસર